

RAN-2401001202030007
F.Y.B.A. (Semester-II) Examination March - 2026
Economics-II - Minor : Theory of Value
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) જમણી બાજુ પ્રશ્નોના ગુણ દર્શાવવામાં આવ્યા છે. The question marks are shown on the right. (3) બધાજ પ્રશ્નો ફરજિયાત છે. All questions are mandatory.	Seat No.: Student's Signature
---	---

- પ્ર-1. નીચેના પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ પાંચ) 10**
- 1) અલ્પહસ્તક હરીફાઈનો અર્થ જણાવો.
 - 2) પેઢીની સમતુલાની શરતો જણાવો.
 - 3) વેચાણ ખર્ચનો અર્થ જણાવો.
 - 4) કાર્ટેલ એટલે શું?
 - 5) કિંમત ભેદભાવ એટલે શું?
 - 6) સીમાંત ઉત્પાદકતાનો અર્થ જણાવો.
 - 7) વાસ્તવિક વેતન એટલે શું?
- પ્ર-2. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળાની પેઢીની સમતુલા આકૃતિની મદદથી સમજાવો. 13**
- અથવા**
- પ્ર-2. અ) ઈજારવાળા બજારના લક્ષણો સમજાવો. 07**
- બ) વેચાણ ખર્ચની માંગરેખા પરની અસરો સમજાવો. 06**
- પ્ર-3. વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની ટીકાત્મક ચર્ચા કરો. 13**
- અથવા**
- અ) રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંતની મર્યાદાઓ સમજાવો. 07**
- બ) અલ્પહસ્તક ઈજારાના લક્ષણો સમજાવો. 06**
- પ્ર-4. ટૂંક નોંધો લખો. (કોઈ પણ બે) 14**
- 1) કિંમત ભેદભાવના પ્રકારો.
 - 2) ખાંચવાળી માંગરેખા.
 - 3) વહેંચણીનો આધુનિક સિદ્ધાંત.
 - 4) ભાડા જેવી આવક.

ENGLISH VERSION

Q-1.	Answer the following question briefly. (Any five)	10
	1) Define oligopoly.	
	2) State the conditions of equilibrium of a firm.	
	3) Define selling cost.	
	4) What is a cartel?	
	5) What is price discrimination?	
	6) Define marginal productivity.	
	7) What is real wage?	
Q-2.	Explain the short-run equilibrium of a firm under perfect competition with the help of a diagram.	13
	OR	
Q-2.	A) Explain the features of a monopoly market.	07
	B) Explain the effects of selling cost on the demand curve.	06
Q-3.	Critically examine the Marginal Productivity Theory of Distribution.	13
	OR	
	A) Explain the limitations of principal of rent by prof. Ricardo.	06
	B) Explain the features of oligopoly.	07
Q-4.	Write short notes. (Any two)	14
	1) The types of price discrimination.	
	2) Kinked demand curve.	
	3) Modern theory of distribution.	
	4) Quasi-rent.	
